



Cosmo Foundation
A Community outreach initiative of
Cosmo Films Limited

ઔદ્યોગિક એકમનું સામાજિક ઉત્તરદાયિત્વ

કોસ્મો ફિલ્મ્સ લિમિટેડ

ત્રિમાસિક પત્રિકા

જાન્યુઆરી થી માર્ચ - ૨૦૨૨

ગ્રામ્ય બાળકો તથા યુવાનોનું શિક્ષણ દ્વારા ક્ષમતા વર્ધન

ઇસ્યુ - 33

વ્હાલાં સાથી મિત્રો, શુભેચ્છકો, વિદ્યાર્થીમિત્રો,

ભારતીય સંસ્કૃતિનાં વિવિધ ઉત્સવોની ઉજવણી, શૈક્ષણિક પ્રક્રિયાઓના નવીન પ્રયોગો, કોસ્મો કોમ્પ્યુટર પુરસ્કાર પ્રતિયોગીતા કસોટી, સ્પોકન ઇંગ્લીશ અને ફંક્શનલ ગ્રામર કોર્સ, શિક્ષકોનું ક્ષમતા વર્ધન, કોસ્મો ઈ-જ્ઞાન સેવા સ્ટેશન, ફળના વૃક્ષ વાવેતર દ્વારા ખેડૂતોની આત્મનિર્ભરતા, કુમાર અને કન્યા શૌચાલય નિર્માણ, ટાઈપીંગ સ્પીડ કોમ્પીટીશન, તરુણી આયુષ બ્રીગેડ દ્વારા બાલિકાઓનું ક્ષમતા વર્ધન તેમજ ગ્રામ્ય સ્તરે ડિજિટલ પ્લેટફોર્મ પર વાલી સંવાદ દર્શાવતી ૩૩મી ત્રિમાસિક પત્રિકા આપની સમક્ષ પ્રસ્તુત કરતા આનંદ અનુભવીએ છે.

રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોની ઉજવણી



હાલમાં જ ૫ મહિના પૂર્વે કોસ્મો ફાઉન્ડેશન ધ્વારા કોલોયાદ હાઈસ્કૂલમાં કમ્પ્યુટર પ્રશિક્ષણ કાર્યક્રમની શરૂ કરવામાં આવ્યો. કોસ્મો ફાઉન્ડેશનના આ અથાગ પ્રયત્નને બિરદાવવા પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા પરિવાર તથા શાળાનાં કેળવણી મંડળ દ્વારા કોસ્મો ફાઉન્ડેશનનું બહુમાન કરવામાં આવ્યું હતું. હોળીના તહેવાર નિમિત્તે 1750 બાળકોને પોષક આહાર અને સાંસ્કૃતિક પરંપરાની શીખ આપવામાં આવી. વિશ્વ વીજળી દિવસ નિમિત્તે 16 બાળકો દ્વારા ૪ ગામોમાં ૨૧૦ પરિવારમાં વીજળી ઓડીટ દ્વારા વીજળી બચાવ અને વીજળીનું મહત્વ દર્શાવતો સંદેશ આપવામાં આવ્યો.

ટાઈપીંગ સ્પીડ કોમ્પીટીશન



વિદ્યાર્થીઓમાં કમ્પ્યુટર ઓપરેશનની સ્કીલ ઈમ્પ્રુવમેન્ટ થાય અને કોઈ પણ ડોક્યુમેન્ટ પ્રોફેશનલ સ્પીડથી કોઈપણ ભૂલ વિના અને યોગ્ય ફોર્મેટમાં ટાઈપીંગ કરતાં શીખે એ માટે કોસ્મો ફાઉન્ડેશનના શિક્ષકો અને યુનિવર્સિટીના ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓએ ૧૦ શાળાના ૮૪ વિદ્યાર્થીઓની ટાઈપીંગ ટેસ્ટ લીધો. જેમાંથી ૧૪ બાળકોનો ખુબ જ ઉત્તમ દેખાવ જોવા મળ્યો હતો, આ સ્પર્ધામાં વિજેતા બાળકોને કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ઈયરફોન ભેટ આપવામાં હતાં.

શિક્ષકોનું ક્ષમતા વર્ધન

- ❖ તારીખ ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ નાં રોજ કોસ્મો ફાઉન્ડેશન, કરજણનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને Organic thinking and Allied વિષય પર વેબિનાર યોજવામાં આવ્યો હતો. તાલીમના તજજ્ઞશ્રી શ્રી પરિમલ મહેતા આ વેબિનારનું શિક્ષણ પ્રદરહો છે. હાલમાં બદલાઈ રહેલ શિક્ષણ પ્રણાલી, ટેકનોલોજી સાથે કેવી રીતે તાલમેલ મેળવી પોતાની જાતને ઓર્ગેનિક (સ્વયં સ્ફૂરણા) સાથે સેલ્ફ લર્નિંગ મોડમાં તૈયાર કરી શકીએ તેનું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને ઓર્ગેનિક થીંકીંગ સાથે ટેકનોલોજી, માર્કેટિંગ દ્વારા વાસ્તવિક જીવનનો વિકાસ કરવાની પ્રેરણા પૂરી પાડી.
- ❖ તારીખ ૧ માર્ચ ૨૨૦૨ ના રોજ કોસ્મો ફાઉન્ડેશન ,બાળમૂર્તિના તંત્રી શ્રી રચનાબેન દવે દ્વારા માનુષાણી ઉત્તમ તાલીમ આપવામાં આવી. બાળકોમાં ભાષાનો વિકાસ સાધવો તેમજ ભાષાનો વિશેષ રમતો દ્વારા ભાષાનું જ્ઞાન અને મહત્વ સમજવામાં આવ્યું. આ ભાષાની ટ્રેનીંગમાં કોસ્મો ફાઉન્ડેશનમાં પાયાનું શિક્ષણ આપતાં ૩૨ બાળમિત્રો એ ભાગ લીધો હતો.



ગ્રામીણ શિક્ષકમાં જ્ઞાનવર્ધન

હું કોસ્મો ફાઉન્ડેશનમાં કોમ્પ્યુટર શિક્ષક તરીકે મારી ભૂમિકા નિભાવુ છું.અમને આ વેબીનાર ખૂબ સારો લાગ્યો જેમાં આપશ્રીએ બાળકોને કેવી રીતે ભણાવવા તેની ખૂબ સરસ સમજ આપી અને પ્રદીપ સર વ્યાસે પણ મિશન હોલ દ્વારા બાળકો કેવી રીતે આગળ વધી શકે તેની પણ ખૂબ સરસ રીતે સમજ આપી કે જેમ એક શિક્ષકે બાળકોને કોઈપણ સમજ આપ્યા વગર હાર્ડવેર શીખવ્યું તે મને ખુબ ગમ્યું અને મારા શિક્ષણમાં મારે આવી ભૂમિકા અપનાવવી જોઈએ અને બાળકો આગળ સાડું અને ઉચ્ચ શિક્ષણ આપી શકાય તે જાણવા મળ્યું. દીપિકા દાયમા, કોમ્પ્યુટર શિક્ષક, પટેલ જે.કે સાર્વજનિક હાઇસ્કૂલ, ગામ : કંડારી.

કોસ્મો કોમ્પ્યુટર પુરસ્કાર પ્રતિયોગીતા કસોટી



કોસ્મો ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કોમ્પ્યુટર શિક્ષણમાં વિદ્યાર્થીઓ સર્વશ્રેષ્ઠ કૌશલ્ય પ્રાપ્ત કરે તે હેતુને સિદ્ધ કરવા છેલ્લાં ૧૦ વર્ષથી કોમ્પ્યુટર પ્રશિક્ષણમાં સર્વશ્રેષ્ઠ દેખાવ બદલ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે .જેનાં ભાગરૂપે તારીખ ૨૨/૨૦૨૨ નાં રોજ ઓન લાઇન પ્લેટફોર્મ પર ગુગલ ફોર્મનાં માધ્યમથી પ્રથમ તબક્કાનું મૂલ્યાંકન યોજવામાં આવ્યું . આ મૂલ્યાંકનમાં કોસ્મો . ફાઉન્ડેશન સંલગ્ન ૧૧ શાળાનાં ૧૫૬ વિદ્યાર્થીઓમાંથી ૧૧૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેનાં પરિણામ . સ્વરૂપરૂઢ વિદ્યાર્થીઓ આખરી તબક્કાની કસોટીમાં ભાગ લીધો.કોમ્પ્યુટર ઓપરેશન ડીજીટલ લીટરસી, , ગુજરાતી ભાષા સજ્જતા, ગણિત, અંગ્રેજી કમ્પ્યુનિકેશનકેશન, સામાન્ય જ્ઞાન અને વિશ્લેષણાત્મક વિષયોને આવરી લઈ થીયરી અને કોમ્પ્યુટર વિષયની પ્રેક્ટીકલ મૂલ્યાંકન તેમજ વિદ્યાર્થી જીવનનાં લક્ષ્ય અને પ્રતિબદ્ધતાઅંગે મૌખિક ઈન્ટરવ્યુ યોજવામાં આવ્યા. જેમાં ૨૯ માંથી ૨૬ વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

સ્પોકન ઈંગ્લીશ અને ફંક્શનલ ગ્રામર કોર્સ

બોડકા ગામમાં ૯મા અને ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વ્યાકરણના કેશ કોર્સનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડની પરીક્ષાઓમાં સામૂહિક સ્કોરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓફલાઇન અંગ્રેજી વર્ગો અઠવાડિયામાં બે વાર લેવામાં આવ્યા હતા. જેમાં Active Passive Voice, Picture Comprehension, Tenses, Story Telling જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શાળા અને વિદ્યાર્થીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. Basic English Learning Module Online Portal માં વિદ્યાર્થીઓ, વાલીઓ, ગૃહિણીઓ, સંસ્થાઓ અને અનેક રસ ધરાવતા ૧૦૫૦ વ્યક્તિઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને ૧૭૨૦૦ વ્યક્તિઓ સાથે પાછલા એક વર્ષમાંઆ વિડીયો જોયા છે



કોસ્મો ઇ જ્ઞાન સેવા સ્ટેશન



કરજણ તાલુકાનાં હાંડોદ ગામમાં “કોસ્મો ઇ જ્ઞાન સેવા સ્ટેશન” શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક ગ્રામજનોને વિવિધ પ્રકારની ડિજિટલ ઇ સેવાઓ અને શૈક્ષણિક સેવાઓ પોતાનાં ગામમાં કોઈપણ પ્રકારના સર્વિસ ચાર્જ વિના ઉપલબ્ધ છે. કોસ્મો ફાઉન્ડેશન સંચાલિત કોસ્મો ઇ જ્ઞાન સેવા સ્ટેશનનાં માધ્યમથી છેલ્લાં ૮ મહિનામાં ૮૦૦ થી વધારે ઇ સર્વિસ અને શૈક્ષણિક સેવાઓનો સ્થાનિક ગ્રામજનોએ લાભ મેળવ્યો. જેમાં ૧૦૦ ઇ શ્રમ કાર્ડ, ૧૦૦ આધાર કાર્ડ, ૧૫૦ ખેડૂત સહાયના ફોર્મ, ૧૩૯ કોવિડ વેક્સીન સર્ટીફિકેટસ ડાઉનલોડ, ૫૦ ઓન લાઈન જોબ એપ્લીકેશન, ૭૫ જેટલા વિદ્યાર્થીઓના સ્કોલરશીપ ફોર્મ, ૪૬ ખેલ મહાકુંભના ઓન લાઈન રાજીસ્ટ્રેશન ઉપરાંત ૨૦ પ્રકારની અનેકવિધ સર્વિસ પૂરી પાડવામાં આવી. સ્થાનિક લાભાર્થી ગ્રામજનો જણાવે છે, કોસ્મો ઇ જ્ઞાન સેવા સ્ટેશનથી અમને ખુબ મોટી મદદ મળી છે, અમારો, સમય શક્તિ અને નાણાની બચત થાય છે.

ફળ ઝાડ વાવેતર દ્વારા ખેડૂતોની આત્મનિર્ભરતા



પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, અમદાવાદ અને કોસ્મો ફાઉન્ડેશનનાં ઉપક્રમે કરજણ તાલુકાનાં ૧૦ ગામના ૬૬ ખેડૂતો માટે ફળ ઝાડ પ્રકલ્પ હેઠળ આંબા બગીચાઓનું સંવર્ધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખેડૂતોની તાલીમના ભાગરૂપે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદનાં સંયુક્ત ઉપક્રમે વડોદરા સ્થિત વરસાડા ગામની આંબાવાડીનો પ્રેરણા પ્રવાસ યોજવામાં આવ્યો. જેમાં લાભાર્થી ખેડૂતોને ફુટ ટ્રી પ્લાન્ટેશન મેનેજમેન્ટ પ્રત્યક્ષ સ્થળ મુલાકાત દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ પ્રવાસમાં કરજણ તાલુકાના કોસ્મો ટ્રી પ્લાન્ટેશન પ્રોજેક્ટ અંતર્ગત જોડાયેલ ૩૦ ખેડૂત ભાઈઓ-બહેનોએ ભાગ લીધો. આ પ્રેક્ટિકલ મુલાકાતમાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા આંબાના પ્લાન્ટની અવસ્થાઓ, ફૂલમાંથી ફળ કેવી રીતે બને, પાણીનું વ્યવસ્થાપન, સુકી ડાળીઓનો કેરી સાથેનો રોલ, સુર્યપ્રકાશનો ઉપયોગ, સુકાપાનની વિવેકપૂર્વક ઉપયોગ અને ચાલુ વર્ષે તેનો ફાયદો કઈ રીતે મેળવવો, ડ્રીપ ઇરીગેશન, સુક્ષ્મ પિયત વ્યવસ્થાથી આંબામાં ઉત્પાદનમાં વધારો, સ્ટ્રેસ કેવી રીતે તોડવો, વગેરે વિષયો પર પ્રેક્ટિકલ ઉદાહરણો દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું.

કુમાર અને કન્યા શૌચાલય નિર્માણ



બાળકોમાં સ્વચ્છતાની આદતો કેળવાય અને તેમજ શૌચાલયના સાચા ઉપયોગ માટે સારી આદતો કેળવાય. બાળકો શૌચાલયનો ઉપયોગ કરતા થાય જેથી તેમનાં આરોગ્ય અને સ્વાસ્થ્ય જાળવાઈ રહે એ હેતુથી કરજણ તાલુકાની ૧૦ શાળામાં ૩ કન્યા અને ૮ કુમાર શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું. આ શૌચાલય નિર્માણ માટે શાળા પરિવાર કોસ્મો ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરે. શૌચાલયની ઝલક.

<https://drive.google.com/file/d/1zg4GW9yn9blona3jNDXifwuSATmKvVlm/view?usp=drivesdk>



“ડિજિટલ પ્લેટફોર્મ” પર વાલી સંવાદ



તારીખ ૧૦/૨/૨૦૨૨ ના રોજ વાલી સંવાદમાં આપનો કીમતી સમય ફાળવી ખૂબ સરળ ભાષામાં ડિજિટલ શિક્ષણની અગત્યતા, તેમાં વાલીની ભૂમિકા, ડિજિટલ શિક્ષણથી થતાં ફાયદા અને નુકશાન જેવા વિષય પર યોજવામાં આવ્યો હતો. આ સંવાદમાં ૮૦ થી વધારે વિદ્યાર્થી અને વાલીઓ જોડાયા. તજજ્ઞ શ્રી શ્રી વિક્રમસિંહ ગોહિલ, આચાર્યશ્રી, શ્રીજીકૃપા સાર્વજનિક વિદ્યાલય, ગામ : કોલીયાદ દ્વારા આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

તારીખ ૧૮/૩/૨૦૨૨ ના રોજ વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે ખુબ જ સરળ ભાષામાં બોર્ડ પરિક્ષાની પૂર્વ તૈયારી સાથે વિદ્યાર્થીની શિક્ષણ પ્રક્રિયામાં વાલીઓની ભૂમિકાઓની ખુબ જ ઉપયોગી માહિતી આપી. ગણિત અને વિજ્ઞાન જેવાં કઠીન વિષયને પણ સરળ રીતે કેવી રીતે પાકો કરી શકાય તેવા વિષય પર યોજવામાં આવી હતી. તજજ્ઞ શ્રી મુકેશભાઈ ભટ્ટ, આચાર્યશ્રી, પૂજ્યશ્રી જશુબા સ્વામી વિદ્યામંદિર, ગામ મેથી દ્વારા આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.



તરુણી આયુષ બ્રીગેડ દ્વારા બાલિકાઓનું ક્ષમતા વર્ધન



તરુણી આયુષ બ્રીગેડ વડોદરા અંતર્ગત પોષણ, આરોગ્ય અને સશક્તિકરણનાં કાર્યક્રમનું અમલીકરણ છ માસથી ચાલી રહ્યું છે. આ કાર્યક્રમ હેઠળ વડોદરા જીલ્લાની ૨૦૦ તરુણીઓને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, સુરક્ષા, શિક્ષણ અને સંરક્ષણ પર શિક્ષિત કરવામાં આવી. આ તરુણી બ્રીગેડની બાળાઓ તેમની શાળાઓમાં અન્ય તરુણીઓમાં જાગૃતિ કાર્યક્રમો કરશે. તરુણી આયુષ બ્રીગેડના આ કાર્યક્રમ વડોદરા જીલ્લાનાં કરજણ તાલુકામાં પણ કાર્યરત છે. જીલ્લા આયુષ અધિકારીશ્રી, વડોદરા દ્વારા સરકારી શાળાની ૨૦૦ જેટલી તરુણીઓ સન્માનની સહભાગી બની. કોસ્મો ફાઉન્ડેશન દ્વારા આ તરુણીઓને હાઇજીન કીટ (સેનીટાઇઝર, માસ્ક, નેપકીન, સેનેટરી પેડ અને સાબુ)નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત કરજણ

તાલુકાની શ્રીમતિ કે.ટી.પટેલ પ્રાથમિક શાળા, ગામ: કંડારી અને ઝેડ.જે.પટેલ નુતન હાઇસ્કૂલ, ગામ : કુરાલીની ધોરણ ૬ થી ૧૦ ની વિદ્યાર્થીનીઓને સન્માનિત કરવામાં આવી. આ કાર્યક્રમ કંડારી અને કુરાલીનાં આયુર્વેદિક ઓપીડી હોમીયોપોથી વિભાગનાં પ્રિયંકાબેન અને સ્નેહલબેન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળા પરિવાર, કોસ્મો ફાઉન્ડેશનનાં સભ્યો અને જીલ્લા પંચાયત/તાલુકા પંચાયત સદસ્યશ્રીઓએ હાજર રહી તરુણીઓને પ્રાસંગિક ઉદબોધન દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી.

તરુણી આયુષ બ્રીગેડ દ્વારા બાલિકાઓનું ક્ષમતા વર્ધન

મહિલા અને બાળવિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય અને વડોદરા જીલ્લા વહીવટી તંત્રનાં ઉપક્રમે સર સયાજીનગર ગૃહમાં મહિલાદિનની ઉજવણી સંસદ સભ્યશ્રી રંજનબેન ભટ્ટના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી. આ કાર્યક્રમમાં વડોદરા શહેરનાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, મ્યુનીસીપલ કમિશનરશ્રી તથા જીલ્લા કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરેલ યુવતીઓ તેમજ આંગણવાડી કાર્યકરો અને આરોગ્ય કાર્યકરોને બીરદાવવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જીલ્લા આયુષ અધિકારી દ્વારા નિર્મિત “બાલિકા આયુષ બ્રીગેડ” જે ૪૦ શાળાઓમાંથી ૨૦૦ યુવતીઓને તાલીમ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ બાલિકાઓનું સન્માન કોસ્મો ફાઉન્ડેશન દ્વારા હાઇજીન કીટ વિતરણ ધ્વારા” મહાનુભાવોના હસ્તે આર્પણ કરીને કરવામાં આવ્યું.



ગ્રામીણ વિદ્યાર્થીમાં શિક્ષણ દ્વારા પરિવર્તન



મારું નામ રોહિત પ્રિયંકા ભૂપેન્દ્રભાઈ છે. હું હાંડોદ ગામ માં રહું છું. હું ધોરણ-૧૦માં અભ્યાસ કરું છું. મારી શાળા નું નામ શ્રીમતી એન.આર.પટેલ સાર્વજનિક વિદ્યાલય છે. છેલ્લા સાત વર્ષથી કોસ્મો ફાઉન્ડેશન માં જોડાયેલી છું. મને કોરોના કાળ દરમિયાન કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ઓનલાઇન મેળવી રહી હતી. કોરોના ના સમયમાં મને વોટ્સએપ ના માધ્યમ થી ડિજિટલ લિટરસી, અંગ્રેજી, ગણિત, કોમ્પ્યુટર વગેરે વિષયમાં નવું નવું શીખવાડવામાં આવ્યું હતું. ત્યારબાદ હું FDI ના ગ્રુપ માં જોડાઈ . ગ્રુપમાં જોડતા પહેલા મને ગૂગલ ડ્રાઈવ, ગૂગલ કોમ, ગૂગલ ફોટોઝ, વગેરે ઓનલાઇન પ્લેટફોર્મ ની જાણકારી મારી પાસે ન હતી. ઓનલાઇન પ્લેટફોર્મ ની દરેક માહિતી મને કોસ્મો ફાઉન્ડેશન દ્વારા મળી. મને ધોરણ ૧૦ માં કોસ્મો ફાઉન્ડેશન નો ઘણો બધો સાથ સહકાર મળ્યો. ઓનલાઇન ગણિત - વિજ્ઞાન વિષય ઝૂમ એપ્લિકેશન દ્વારા ભણાવવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા માં મને માર્ગદર્શન સૌથી વધારે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા મળ્યું હતું. જેથી મારા બોર્ડ ની પરીક્ષા માં મારા દરેક પેપર સારા ગયા. મને છેલ્લા સાત વર્ષથી કોસ્મો ફાઉન્ડેશન નો ઘણો સાથ-સહકાર મળે. મને તારે કારકિર્દી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. અને મને કોમ્પ્યુટર પણ શીખવાડવામાં આવે છે. હું એ કોમ્પ્યુટર એવોર્ડ ની પણ પરીક્ષા આપેલી છે. જેમાં મારા પ્રેરણાત્મક શિક્ષકો નિશા મેડમ, સોનલ મેડમ, દિવ્યજીતસર અને દીપિકા મેડમ હતા. કોસ્મો ફાઉન્ડેશન ના કારણે મને નવું જાણવા અને શીખવા મળ્યું. તેની સાથે -સાથે મારા મગજ નો પણ વિકાસ થયો. અને કોસ્મો દ્વારા મને ઘણું બધું શીખવા મળે છે. અને મને આગળ પણ ઘણું બધું શીખવા મળશે. આ મારો પોતાનો અનુભવ છે. Thank you so much Cosmo Foundation

ફોટો ગેલેરી



નમ્ર નિવેદન :

આપશ્રીને આમરું નમ્ર નિવેદન છે કે ગુણવત્તા સભર શિક્ષણ દ્વારા જીવન નિર્માણની આ નિરંતર યાત્રામાં આપ સૌ તથા આપના પરિવારના સદસ્યો અને મિત્રો પોતાના જ્ઞાન, આવડત, સંસાધનોના યોગદાન દ્વારા સક્રિયતાથી ભાગ લો જેથી સમગ્ર સમાજમાં એક સકારાત્મક માનવીય વિકાસની ઝાંખી કરી શકીએ વધુ માહિતી માટે અમને કૃપયા સંપર્ક કરો. /cosmofoundation /cf.cosmofoundation

